

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦
તા.૨૭/૦૮/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૫૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૯ કેસ કરી, ૧૩ વ્યક્તિઓને ઝડપી, ૨૭ લીટર દેશી દારૂ, ૫૮ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૩ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧૨ કેસ કરી ૭૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૧૭,૫૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૫૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૬૫૫/૧૮

નારોલ: નીલેશભાઈ જયંતીભાઈ પરમાર (રહે,પુષ્પમાલા સોસાયટી, પારસનગર બસ સ્ટેંડ વટવા ઇસનપુર રોડ વટવા) એ તા.૨૬/૮/૧૮ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૮/૧૮ કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે ઇસનપુર વટવા રોડ મુખીની વાડી આગળ રોડ ઉપર અજાણ્યા રીક્ષા ચાલકે રીક્ષા પુરઝડપે અને બેદરકારીથી ચલાવી નીલેશભાઈના પિતા જયંતીભાઈને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૬/૮/૧૮ કલાક ૭/૫૫ વાગે જયંતીભાઈનું મૃત્યુ નિપજ્યુ હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.રાઠોડ ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૬૫૬/૧૮

અમરાઇવાડી: સન્મુખભાઈ અમરતલાલ ડબગર (ઉ.વ.૬૦) (રહે.સિધ્ધનાથ એપાર્ટમેન્ટ પાસે બાગે ફીરદોસ પોલીસ લાઇન વિભાગ-૨ ની અંદર જોગેશ્વરી રોડ અમરાઇવાડી) તા.૧૨/૮/૧૮ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ચાલુ પ્રાયમસમાં કેરોસીન ભરતા હતા ત્યારે ભડકો થતા દાઝી ગયા હતા. સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૬/૮/૧૮ કલાક ૧૦/૪૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રાજેન્દ્રકુમાર આત્મારામ ચલાવે છે.

વેજલપુર: કૈલાસબહેન વા/ઓ જયેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) (રહે. વૃંદાવન ફ્લેટ સત્યમ ફ્લેટની બાજુમા વેજલપુર) એ અગમ્ય કારણસર તા.૧૬/૮/૧૮ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લીધુ હતુ. સારવાર માટે વા.સા.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આઇ.ડી.પટેલીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.